



## પૂરનું પાણી તમને બીમાર કરી શકે છે

- પૂરનાં પાણીમાં ગટરનું પાણી, રસાયણો અને કચરો હોય શકે છે, જેનાથી ગંભીર બીમારી અને ઇજાઓ થઈ શકે છે
- પૂરના પાણીમાં ક્યારેય તરવું નહિં
- પૂર પછી સફાઈ કરતી વખતે પોતાની જાતને સુરક્ષિત રાખો તથા માસ્ક, બૂટ અને હાથનાં મોજા પહેરો
- રોગ થતો રોકવા માટે, પૂરના પાણીનાં સંપર્કમાં આવ્યા પછી તમારા હાથ સાબુ અને પાણીથી ધુઓ.

જો તમને આરોગ્યને લગતી કોઈ પણ ચિંતાઓ હોય અને ભાષાકીય સહાયની જરૂર હોય, તો TISને 131 450 પર ફોન કરો અને હેલ્થ ડિરેક્ટને 1800 022 222 પર જોડી આપવા કહો

